

અરબી-ગુજરાતી

# કુરઆને મજીદ

પારા-૧

- : પ્રકાશક : -

હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

માળી ટેકરા, આંબાચોક, ભાવનગર

ફોનનંબર : (૦૨૭૮) ૨૫૧૦૦૫૬ / ૨૪૨૩૭૪૬

... Kitab Downloaded from ...

[www.hajinaji.com](http://www.hajinaji.com)

● **LIKE US ON FACEBOOK** ●

**HOME** | કુરઆને મજીદ (પારા-૧) -1 | **VISIT US**

# નોંધ.....

→ વધુ કિતાબો ડાઉનલોડ કરવા માટે [www.hajinaji.com](http://www.hajinaji.com) પર લોગ ઓન કરો.

→ કિતાબમાં કોઈ ભૂલચૂક જણાય તો જાણ કરવા વિનંતી.

[hajinajitrust@gmail.com](mailto:hajinajitrust@gmail.com)

# અનુક્રમણિકા

નં.	સૂરાનું નામ	પેજ
૧	સૂર-એ-ફાતેહા (આયત ૧ થી ૭)	૪
૨	સૂર-એ-બકરહ (આયત ૧ થી ૧૪૧)	૬

## سورة الفاتحة / સુર-એ-ફાતેહા

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

અલ્લાહના નામથી (શરૂ કરું છું) જે ઘણો મહેરબાન  
(કૃપાળુ), બહુજ રહેમ (દયા) વાળો છે.

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ ①

(૧) સર્વ વખાણ અલ્લાહને જ માટે છે જે દરેક  
(તમામ) જગતનો પાલનહાર છે.

الرَّحْمَنِ الرَّحِيمِ ②

(૨) જે ઘણો મહેરબાન રહેમવાળો છે.

مَلِكِ يَوْمِ الدِّينِ ③

(૩) જે બદલાના દિવસ (કયામત)નો માલિક છે.

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ ﴿٤﴾

(૪) (અથ અલ્લાહ) અમે તારીજ બંદગી કરીએ છીએ અને (દરેક કામમાં) તારાથી જ મદદ યાહીએ છીએ.

إِهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ ﴿٥﴾

(૫) તું અમને સીધા માર્ગ પર કાયમ રાખ.

صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ ۚ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ  
وَلَا الضَّالِّينَ ﴿٦﴾

(૬) તે લોકોના માર્ગ પર જેઓ પર (પોતાની) તેં ઈન્આમ-નેઅમત (બક્ષીસો) આપી છે. તેઓનો માર્ગ નહિ જેઓ પર તારો ગઝબ થયો અને ન તેઓનો માર્ગ જેઓ અવળે માર્ગે (ગુમરાહ થઈ) ગયા.

## سورة البقرة / સુરએ બકરહ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

અલ્લાહના નામથી (શરૂ કરું છું) જે ધણો મહેરબાન  
(કૃપાળુ), બહુજ રહેમ (દયા) વાળો છે.

الْمَرَّةِ ①

(૧) અલિફ - લામ - મીમ.

ذَلِكَ الْكِتَابُ لَا رَيْبَ فِيهِ هُدًى لِّلْمُتَّقِينَ ②

(૨) આ કિતાબ એવી છે જેમાં કોઈ પણ પ્રકારની  
શંકા નથી. તે ગુનાહોથી બચનારાઓ માટે સન્માર્ગ  
દર્શક છે.

الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ  
يُنْفِقُونَ ﴿٣﴾

(3) જેઓ અદ્રશ્ય (બાબતો) માં માને છે તથા નમાઝ કાયમ કરે છે અને અમોએ તેમને જે કાંઈ આપ્યું છે તેમાંથી (અમારા માટે) ખર્ચ કરે છે.

وَالَّذِينَ يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِنْ قَبْلِكَ ۗ  
وَبِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ ﴿٤﴾

(4) અને (અથ રસૂલ !) જે (કુરઆન) તારા પર ઉતારવામાં આવ્યું છે, તથા જે (ઈલાહી કિતાબો) તારી પહેલાં ઉતારવામાં આવી છે, તેના ઉપર

તેઓ ઈમાન લાવે છે અને કયામતના દિવસમાં  
(પણ) તેઓ સંપૂર્ણ વિશ્વાસ રાખે છે.

أُولَئِكَ عَلَىٰ هُدًى مِّن رَّبِّهِمْ ۗ وَأُولَئِكَ هُمُ الْمُفْلِحُونَ ﴿٥﴾

(૫) એજ લોકો પોતાના પરવરદિગારના સરળ  
માર્ગ ઉપર છે અને તેઓ જ સફળતા પામનારા  
છે.

إِنَّ الَّذِينَ كَفَرُوا سَوَاءٌ عَلَيْهِمْ ءَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ

لَا يُؤْمِنُونَ ﴿٦﴾

(૬) નિઃસંશય જેઓ (સમજ્યા છતાં) માનતા નથી,  
તું તેમને ડરાવે કે ન ડરાવે એ તેમના માટે સરખું  
(જ) છે; તેઓ (હરગિઝ) ઈમાન લાવશે નહિ.



خَتَمَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَعَلَىٰ سَمْعِهِمْ ۖ وَعَلَىٰ أَبْصَارِهِمْ  
غِشَاوَةً ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ ﴿٤٤﴾

(૭) તેમના અંતઃકરણો ઉપર તથા તેમના કાનો ઉપર અલ્લાહે મહોર મારી દીધી છે, અને તેમની આંખો ઉપર પડદો છે, અને તેમના માટે ઘણી મોટી શિક્ષા છે.

وَمِنَ النَّاسِ مَنْ يَقُولُ آمَنَّا بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَمَا هُمْ  
بِمُؤْمِنِينَ ﴿٨﴾

(૮) અને લોકોમાંથી (કેટલાક) એવા છે જેઓ (જાહેરમાં) કહે છે કે અમે અલ્લાહ તથા કયામતના

દિવસ પર ઈમાન લાવ્યા છીએ, જો કે (ખરૂં જોતાં)  
તેઓ ઈમાન લાવ્યા નથી.

يُخَدِّعُونَ اللَّهَ وَالَّذِينَ آمَنُوا ۗ وَمَا يَخْدَعُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا  
يَشْعُرُونَ ۙ ﴿٩﴾

(૯) (આમ કરીને) તેઓ અલ્લાહને તથા જેઓ  
ઈમાન લાવ્યા છે, તેમને છેતરવા માગે છે; પણ  
(ખરૂં જોતાં) તેઓ પોતાના સિવાય બીજા કોઈને  
છેતરતા નથી, પરંતુ તેમને (તેનું) ભાન નથી.

فِي قُلُوبِهِمْ مَّرَضٌ ۖ فَزَادَهُمُ اللَّهُ مَرَضًا ۗ وَلَهُمْ عَذَابٌ  
أَلِيمٌ ۙ بِمَا كَانُوا يَكْذِبُونَ ﴿١٠﴾

(૧૦) તેમના અંતઃકરણોમાં (એક પ્રકારનો) રોગ છે તેથી અલ્લાહે તેમના (તે) રોગમાં વધારો કર્યો, અને તેમના માટે દુઃખદાયક શિક્ષા છે, કારણકે તેઓ જૂઠું બોલતા હતા.

وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ قَالُوا إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ ⑩

(૧૧) અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે પૃથ્વી પર ફસાદ ફેલાવો નહિ, ત્યારે તેઓ કહે છે કે અમે તો (લોકોમાં) માત્ર સુધારણા કરાવનારા છીએ.

أَلَا إِنَّهُمْ هُمُ الْمُفْسِدُونَ وَلَكِن لَّا يَشْعُرُونَ ⑪

(૧૨) ખબરદાર ! નિઃસંશય એજ લોકો ફસાદ ફેલાવનારા છે, પરંતુ (તેનું) તેમને ભાન નથી.

وَإِذَا قِيلَ لَهُمْ لَهُمْ آمِنُوا كَمَا آمَنَ النَّاسُ قَالُوا أَنُؤْمِنُ كَمَا

آمَنَ السُّفَهَاءُ ۗ إِلَّا إِنَّهُمْ هُمُ السُّفَهَاءُ وَلَكِنْ لَا يَعْلَمُونَ ﴿١٣﴾

(૧૩) અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે જેમ બીજા લોકો ઈમાન લાવ્યા છે તેમ તમે પણ ઈમાન લાવો ત્યારે તેઓ કહે છે કે શું અમે એવી રીતે ઈમાન લાવીએ કે જેવી રીતે તે મૂર્ખાઓ ઈમાન લાવ્યા છે? ખબરદાર ! એ લોકો પોતે મૂર્ખ છે પણ (તે) તેઓ જાણતા નથી.

وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا إِلَىٰ

شَيْطَانِهِمْ قَالُوا إِنَّمَا مَعَكُمْ ۖ إِنَّمَا نَحْنُ مُسْتَهْزِءُونَ ﴿١٤﴾

(૧૪) અને જ્યારે તેઓ ઈમાન લાવનારાઓની મુલાકાત કરે છે. ત્યારે કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ, અને જ્યારે એકાંતમાં પોતાના શયતાનો (આડે માર્ગે દોરવનારા આગેવાનો) ને મળે છે ત્યારે કહે છે કે બેશક અમે તો તમારી જ સાથે છીએ, અમે તો (તે મુસલમાનોની) માત્ર મજાક કરીએ છીએ.

اللَّهُ يَسْتَهْزِئُ بِهِمْ وَيَمُدُّهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ ﴿١٥﴾

(૧૫) અલ્લાહ (પણ) તેમની મજાક કરે છે તથા તેમને તેમના ઉદ્ધતાઈમાં (અધર્મીપણામાં) આંધળાઓની જેમ ભટકતા રહેવા દે છે.

أُولَئِكَ الَّذِينَ اشْتَرُوا الضَّلَالَةَ بِالْهُدَىٰ ۖ فَمَا رَبَحَتُ  
تِجَارَتِهِمْ وَمَا كَانُوا مُهْتَدِينَ ﴿١٦﴾

(૧૬) આ લોકો તેજ છે જેમણે ખોટો રસ્તો ખરા રસ્તાના બદલે વેચાતો લીધો છે, તેથી ન તો તેમના (આ) વેપારે તેમને નફો પહોંચાડ્યો છે અને ન તો તેઓ સાચો રસ્તો પામેલા છે.

مَثَلُهُمْ كَمَثَلِ الَّذِي اسْتَوْقَدَ نَارًا ۖ فَلَمَّا أَضَاءَتْ مَا حَوْلَهُ  
ذَهَبَ اللَّهُ بِنُورِهِمْ وَتَرَكَهُمْ فِي ظُلُمٍ ۗ لَا يُبْصِرُونَ ﴿١٦﴾

(૧૭) તેમનો દાખલો તે (માણસ)ના જેવો છે કે જેણે આગ સળગાવી, પછી જ્યારે આગથી ચારેબાજુ (દેખાતું) અજવાળું થયું ત્યારે અલ્લાહે તેમની (આંખોની) રોશની લઈ લીધી અને તેમને એવા એક અંધકારમાં છોડી દીધા કે (જેથી હવે) તેમને કાંઈ પણ સૂજતું (દેખાતું) નથી.

صُمُّبُكُمْ عُمِّي فَهُمْ لَا يَرُجُونَ ﴿١٨﴾

(૧૮) (તેઓ) બહેરા, ગુંગા (અને) આંધળા છે, તેથી (હવે અધર્મથી) તેઓ (ખરા માર્ગ ઉપર) પાછા ફરશે નહીં.

أَوْ كَصَيْبٍ مِّنَ السَّمَاءِ فِيهِ ظُلُمَاتٌ وَرَعْدٌ وَبَرْقٌ ۚ يَجْعَلُونَ  
أَصَابِعَهُمْ فِي آذَانِهِمْ مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِ ۗ وَاللَّهُ  
مُخِيطٌ بِالْكَافِرِينَ ۝۱۹

(૧૯) અથવા તેમનો દાખલો (આકાશમાંથી પડતા એવા એક) ધોધમાર વરસાદના જેવો છે, કે જેમાં અંધકાર હોય તથા ગર્જના તથા વિજળી પણ; કડાકાઓનો અવાજ સાંભળી મૃત્યુના ભયથી તેઓ પોતાના કાનોમાં આંગળા નાંખી દે છે; અને અલ્લાહ નાસ્તિકોને (પોતાની શક્તિથી) ઘેરી રાખે છે.



يَكَادُ الْبَرُّقُ يَحْطِفُ أَبْصَارَهُمْ ط كَلَّمَا أَضَاءَ لَهُمْ مَشَوْا  
 فِيهِ ۖ وَإِذَا أَظْلَمَ عَلَيْهِمْ قَامُوا ط وَلَوْ شَاءَ اللَّهُ لَذَهَبَ  
 بِسَمْعِهِمْ وَأَبْصَارِهِمْ ط إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ﴿٢٠﴾

(૨૦) એ સમય પાસે છે કે વિજળી (ના ચમકારા) તેમની આંખોની રોશનીને છીનવી લઈ જાય; જ્યારે જ્યારે પણ તે (વિજળી) તેમને પ્રકાશ આપે છે ત્યારે ત્યારે તેમાં તેઓ ચાલી નિકળે છે અને તેમના ઉપર અંધકાર થઈ જતાં તેઓ ઉભા રહી જાય છે; અને જો અલ્લાહ યાહતે તો તેમની સાંભળવાની તથા જોવાની શક્તિ જરૂર છીનવી

લેતે; નિશંસય અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબુ ધરાવનારો છે.

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ  
قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ ﴿٢١﴾

(૨૧) અય લોકો! તમે તમારા પરવરદિગારની બંદગી કરો જેણે તમને તથા જેઓ તમારી અગાઉ હતા તેમને પૈદા કર્યા છે, કે કદાચને તમે (ગુનાહથી) બચો.

الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً ۖ وَأَنْزَلَ مِنَ  
السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۗ فَلَا تَجْعَلُوا  
لِلَّهِ أَنْدَادًا ۖ وَأَنْتُمْ تَعْلَمُونَ ﴿٢٢﴾

(૨૨) જેણે જમીનને તમારા માટે બીછાનું બનાવ્યું  
તથા આકાશને એક છત; અને જેણે આકાશમાંથી  
પાણી ઉતાર્યું પછી તે વડે તમારી રોજી માટે ફળો  
પૈદા કર્યા; માટે જાણી જોઈને અલ્લાહના  
બરોબરીયા બનાવો નહીં.

وَإِنْ كُنْتُمْ فِي رَيْبٍ مِّمَّا نَزَّلْنَا عَلَىٰ عَبْدِنَا فَأْتُوا بِسُورَةٍ مِّمَّنْ  
مِثْلِهِ ۖ وَادْعُوا شُهَدَاءَكُمْ مِّنْ دُونِ اللَّهِ إِنْ كُنْتُمْ

صَادِقِينَ ﴿٢٣﴾

(૨૩) અને અમોએ જે (કુરઆન) અમારા બંદા ઉપર ઉતાર્યું છે તેમાં કદાચને તમને શંકા હોય (કે તે અલ્લાહ તરફથી નથી.) તો તેના જેવું એક પ્રકરણ તમે પણ (બનાવી) લાવો, અને અગર તમે સાચા હો તો અલ્લાહ સિવાય તમારા સાક્ષીઓ લઈ આવો.

فَإِنْ لَّمْ تَفْعَلُوا وَلَنْ تَفْعَلُوا فَاتَّقُوا النَّارَ الَّتِي وَقُودُهَا  
النَّاسُ وَالْحِجَارَةُ ۗ أُعِدَّتْ لِلْكَافِرِينَ ﴿٢٣﴾

(૨૪) પછી જો તમે (તેમ)ન કરી શકો - અને તમે તે કોઈ કાળે કરી શકશો નહી - તો તે આગથી ડરો કે જેનું બળતણ માણસો તથા પથ્થરો છે, જે (ખાસ કરીને) નાસ્તીકો માટે તૈયાર કરવામાં આવી છે.

وَبَشِّرِ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أَنَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۖ كُلَّمَا رُزِقُوا مِنْهَا مِنْ ثَمَرَةٍ رِزْقًا ۖ قَالُوا هَذَا الَّذِي رُزِقْنَا مِنْ قَبْلُ ۖ وَأُتُوا بِهِ مُتَشَابِهًا ۖ وَلَهُمْ فِيهَا أَزْوَاجٌ مُطَهَّرَةٌ ۖ وَهُمْ فِيهَا خَالِدُونَ ﴿٢٥﴾

(૨૫) અને (અથ રસૂલ!) તે લોકોને, કે જેઓ ઈમાન લાવ્યા છે તથા સત્કાર્યો કર્યા છે, ખુશખબર આપ કે તેમના માટે બગીચાઓ (તૈયાર કરવામાં

આવ્યા) છે જેની નીચે થઈને નદીઓ વહે છે. જ્યારે જ્યારે પણ તેમને તેમાંથી ખાવાને માટે કોઈ ફળ આપવામાં આવશે, ત્યારે ત્યારે તેઓ કહશે કે આના જેવા અમને પહેલાં પણ મળી ચૂક્યાં છે, જો કે (ખરી રીતે તો માત્ર) તે દેખાવમાંજ તેના જેવાં હતાં. અને તેમના માટે એ (બગીચાઓ) માં પવિત્ર પત્નિઓ પણ હશે અને તેઓ તેમાં હંમેશ માટે રહેનાર છે.

إِنَّ اللَّهَ لَا يَسْتَحْيِي أَنْ يَضْرِبَ مَثَلًا مَّا بَعُوضَةً فَمَا فَوْقَهَا ط  
فَأَمَّا الَّذِينَ آمَنُوا فَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِنْ رَبِّهِمْ ؕ وَأَمَّا

الَّذِينَ كَفَرُوا فَيَقُولُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَذَا مَثَلًا ۖ لَمْ يُوْضِلْ بِهِ  
كَثِيرًا ۗ وَيَهْدِي بِهِ ۗ كَثِيرًا ۗ وَمَا يُضِلُّ بِهِ إِلَّا الْفٰسِقِينَ ﴿٣١﴾

(૨૬) બેશક, અલ્લાહ એક મચ્છર જેવાનો અથવા તે કરતાંય વધારે નજીવા (જંતુ) નો દાખલો વર્ણવતા શરમાતો નથી; પછી જેઓ ઈમાન લાવ્યા છે તેઓ તો જાણે છે કે તે (દાખલો) તેઓના પરવરદિગાર તરફથી છે (તેમજ) સત્ય છે, પણ જેઓ માનતા નથી તેઓ કહે છે કે આ દાખલાથી અલ્લાહનો શો હેતુ છે? (પણ અલ્લાહ) એવાજ (દાખલાઓથી) ઘણાઓને આડે માર્ગે લઈ જાય છે, અને (વળી) ઘણાઓને તે વડે સન્માર્ગે (પણ) લઈ જાય છે.

الَّذِينَ يَنْقُضُونَ عَهْدَ اللَّهِ مِنْ بَعْدِ مِيثَاقِهِ ۖ وَيَقْطَعُونَ مَا  
 أَمَرَ اللَّهُ بِهِ أَنْ يُوصَلَ وَيُفْسِدُونَ فِي الْأَرْضِ ۗ أُولَٰئِكَ هُمُ  
 الْخٰسِرُونَ ﴿٢٤﴾

(૨૭) જેઓ અલ્લાહ સાથેનો કરાર તેના નક્કી થયા પછી તોડી નાખે છે, અને જે વસ્તુઓ અલ્લાહે જોડવાને ફરમાવ્યું છે તેને કાપી નાખે છે અને પૃથ્વી પર ફસાદ કરતા રહે છે, તેજ લોકો નુકસાનમાં રહેનાર છે.

كَيْفَ تَكْفُرُونَ بِاللَّهِ وَكُنْتُمْ أَمْوَاتًا فَأَحْيَاكُمْ ۖ ثُمَّ  
 يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ ﴿٢٨﴾



(૨૮) અને ક્યા આધારે તમે અલ્લાહનો ઈન્કાર કરો છો? જ્યારે તમે જીવ વગરના હતા ત્યારે તેણે તમને જીવ આપ્યો, પછી તમને મૃત્યુ આપશે અને ફરીથી (બીજીવાર) તમને સજીવન કરશે પછી તમે તેની તરફ પાછા ફેરવવામાં આવશો.

هُوَ الَّذِي خَلَقَ لَكُمْ مَّا فِي الْأَرْضِ جَمِيعًا ۖ ثُمَّ اسْتَوَىٰ إِلَىٰ

السَّمَاءِ فَسَوَّاهُنَّ سَبْعَ سَمَوَاتٍ ۗ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ ﴿٢٩﴾

(૨૯) તે (અલ્લાહ) એ જ છે કે જેણે જમીનની સઘળી વસ્તુઓ તમારા માટે પેદા કરી, પછી આકાશ તરફ ધ્યાન આપ્યું, પછી તેમાંથી સંપૂર્ણ સાત આકાશો બનાવ્યા; અને તે સઘળી વસ્તુઓનો સંપૂર્ણ રીતે જાણનાર છે.

وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلِكَةِ إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً ۗ قَالُوا  
 أَتَجْعَلُ فِيهَا مَنْ يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ ۗ وَنَحْنُ نُسَبِّحُ  
 بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ۗ قَالَ إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ ﴿٣٠﴾

(30) અને (અથ રસૂલ!) તારા પરવરદિગારે  
 જ્યારે ફરિશ્તાઓને કહ્યું કે પૃથ્વી ઉપર હું (મારો)  
 એક પ્રતિનિધિ નિમનાર છું ત્યારે તેમણે અરજ કરી  
 કે શું તું એવા (પ્રતિનિધિ) ની નિમણુંક કરશે કે જે  
 તે (પૃથ્વી) ઉપર ફસાદ અને ખૂનરેઝી કર્યા કરશે?  
 જો કે (ખરેખર તો અમારામાંથીજ પ્રતિનિધિ  
 બનાવવો જોઈએ કારણકે) અમે (સાચા  
 અંતઃકરણથી) તારા ગુણગાન ગાઈએ છીએ તથા

તારી પવિત્રતા વર્ણવીએ છીએ, (અલ્લાહે)  
ફરમાવ્યું કે નિશંસય જે હું જાણું છું તે તમે જાણતા  
નથી.

وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ

أَنْبِئُونِي بِأَسْمَاءِ هَؤُلَاءِ إِنْ كُنْتُمْ صَادِقِينَ ﴿٣١﴾

(૩૧) અને આદમને સઘળા નામો શીખવ્યા, પછી  
તે (નામો) ફરિશ્તાઓ સામે રજૂ કરતાં ફરમાવ્યું જો  
તમે (તમારા દાવામાં) સાચા હો તો તે (વસ્તુઓ)  
ના નામોની મને ખબર આપો.

قَالُوا سُبْحٰنَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ط إِنَّكَ أَنْتَ الْعَلِيمُ

الْحَكِيمُ ﴿٣٢﴾

(૩૨) (ફરિશ્તાઓએ) અરજ કરી કે તું (દરેક એબથી) પાક અને પાકીઝા છે! અમને જે તેં શિખવ્યું છે તે ઉપરાંત અમને કાંઈ જ્ઞાન નથી; બેશક (દરેક) જ્ઞાનનો સંપૂર્ણ જાણનાર અને સત્ય અસત્યનો નિર્ણય કરનાર તુંજ છે

قَالَ يَا أَدَمُ أَنْبِئْهُمْ بِأَسْمَائِهِمْ ۗ فَلَمَّا أَنْبَأَهُمْ بِأَسْمَائِهِمْ ۗ  
 قَالَ أَلَمْ أَقُلْ لَكُمْ إِنِّي أَعْلَمُ غَيْبِ السَّمَوَاتِ وَالْأَرْضِ  
 وَأَعْلَمُ مَا تُبْدُونَ وَمَا كُنْتُمْ تَكْتُمُونَ ﴿٣٣﴾

(૩૩) (અલ્લાહે) ફરમાવ્યું કે અય આદમ! તે (વસ્તુઓ) ના નામો તેમને બતાવી દે. પછી જ્યારે આદમે તે નામો તે (ફરિશ્તા) ઓને બતાવી દીધા,

ત્યારે (અલ્લાહે) ફરમાવ્યું કે શું મેં તમને કહ્યું નહતું કે નિસંશય હું જ આકાશો તથા જમીનના છુપા ભેદોનો જાણનાર છું અને જે કાંઈ તમે જાહેર કરો છો તથા જે કાંઈ તમે છુપાવી રાખો છો તેનાથી (પણ) હું સારી પેઠે વાકેફ છું.

وَأَذُقْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ ط أَبِي  
وَاسْتَكْبَرَ ۗ وَكَانَ مِنَ الْكٰفِرِينَ ۝۳۴

(૩૪) અને જ્યારે અમોએ ફરિશ્તાઓને કહ્યું કે આદમને સિજદો કરો ત્યારે દરેક (ફરિશ્તાઓ) સિજદો કર્યો સિવાય ઈબ્લીસે (શેતાને); તેણે અભિમાનથી ઈન્કાર કર્યો અને તે નાફરમાનો માંહેનો થયો.

وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا  
حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ  
الظَّالِمِينَ ﴿٣٥﴾

(35) અને અમોએ હુકમ કર્યો કે અથ આદમ! તું  
અને તારી પત્નિ સ્વર્ગમાં વસવાટ કરો અને તેમાં  
જ્યાંથી પણ તમારું મન યાહે પેટ ભરીને ખાઓ,  
પણ આ ઝાડ પાસે જશો નહિ, નહિ તો તમે  
ઝુલમગારો માંહેના થઈ જશો.

فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ ۖ وَقُلْنَا  
 اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۗ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ  
 وَمَتَاعٌ إِلَىٰ حِينٍ ﴿٣٦﴾

(૩૬) પછી શૈતાને તે બન્નેને તે (આડના ફળ  
 ખાવા) માટે લલચાવ્યા, જેથી (તેણે) જે સ્થિતિમાં  
 તેઓ હતા તે (સ્થિતિ) માંથી તેમને કઢાવ્યા અને  
 અમે હુકમ કર્યો કે નીચે ઉતરી જાઓ, તમારામાંથી  
 કેટલાક (લોકો) કેટલાક (લોકો)ના શત્રુ છે, અને  
 એક સમય સુધી જમીન પરજ તમારું સ્થાન અને  
 જિંદગીનું સાધન રહેશે.

فَتَلَقَىٰ آدَمُ مِنْ رَبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ ۗ إِنَّهُ هُوَ التَّوَّابُ

الرَّحِيمُ ﴿٣٤﴾

(૩૭) પછી આદમે તેના પરવરદિગાર તરફથી (દુઆ માંગવામાં) થોડાંક વાક્યો શીખી લીધાં જેથી (અલ્લાહે) તેની તોબા કબૂલ કરી; બેશક, તે મહાન તોબા કબૂલ કરનાર અને દયા કરનાર છે.

قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۚ فَإِمَّا يَأْتِيَنَّكُمْ مِنِّي هُدًى فَمَنْ

تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ﴿٣٨﴾

(૩૮) (અને) અમોએ આજ્ઞા કરી કે તમે સઘળા અહીંથી ઉતરી જાઓ; પછી મારા તરફથી તમને જરૂર હિદાયત પહોંચશે, (પછી) જે મારી હિદાયતને



અનુસરી ચાલશે તેમને ન તો કાંઈ ભય રહેશે અને  
ન તો તેઓ ઉદાસ થશે.

وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۗ هُمْ  
فِيهَا خَالِدُونَ ﴿٣٩﴾

(૩૯) અને જેમણે અમારી આયતો (આજ્ઞાઓ) નો  
ઈન્કાર કર્યો તથા તેમને જૂઠલાવી તેઓ  
જહન્નમવાસી છે; તેઓ હંમેશને માટે તેમાંજ રહેનાર  
છે.

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا اذْكُرُوْا نِعْمَتِيْ الَّتِيْ اَنْعَمْتُ عَلَيْكُمْ وَاَوْفُوْا  
بِعَهْدِيْٓ اَوْفٍ بِعَهْدِكُمْ ۗ وَاِيَّايَ فَاَرْهَبُوْنَ ﴿٤٠﴾

(૪૦) અથ ઈસરાઈલના વંશજો! મારી તે બક્ષિશોને યાદ કરો કે જે મેં તમને અર્પણ કરી હતી અને પૂરો કરો મારા કરારને (જેથી) હું પૂરો કરું તમારા કરારને અને તમો માત્ર મારાથીજ ડરતા રહો

وَأْمِنُوا بِمَا آنَزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُونُوا أَوْلَٰ كَافِرٍ

بِهِ ۚ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا ۚ وَإِيَّايَ فَاتَّقُونِ ﴿٤١﴾

(૪૧) અને ઈમાન લાવો તે (કુરઆન) ઉપર જે મેં ઉતાર્યું છે (અને) જે તમારી પાસે (કિતાબો) છે તેની સત્યતા બતાવનાર છે અને તમે સૌથી પહેલા તેનો ઈન્કાર કરનારા બનો નહિ, તથા મારી

આયતોના બદલામાં (સંસારી લાભ માટે) નજીવી કિંમત મેળવો નહિ, અને મારાથીજ ડરતા રહો.

وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَأَنْتُمْ  
تَعْلَمُونَ ﴿٣٣﴾

(૪૨) અને સત્યને અસત્યની સાથે ભેળવી નાખો નહિ, અને સત્ય જાણી જોઈને સંતાડો નહિ.

وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَارْكَعُوا مَعَ الرَّاكِعِينَ ﴿٣٣﴾

(૪૩) અને નમાઝ (હંમેશા) પઢતા રહો તથા ઝકાત આપતા રહો અને રૂકુઅ કરનારાઓ સાથે રૂકુઅ કરો.

أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنْسَوْنَ أَنْفُسَكُمْ وَأَنْتُمْ تَتْلُونَ  
الْكِتَابَ ۗ أَفَلَا تَعْقِلُونَ ﴿٤٣﴾

(૪૪) શું તમે લોકોને તો નેકી (ના કાર્યો) કરવાની આજ્ઞા કરો છો અને પોતાને ભૂલી જાઓ છો? જો કે તમે પણ કિતાબ (તૌરેત) પઢો છો; શું ત્યારે તમે એટલું (પણ) સમજતા નથી?

وَاسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۗ وَإِنَّهَا لَكَبِيرَةٌ إِلَّا عَلَى  
الْخَاشِعِينَ ﴿٤٥﴾

(૪૫) અને ધીરજ તથા નમાઝ વડે (અમારી) મદદ માંગતા રહો અને બેશક તે (નમાઝ પઢવી)

એક ભારે (કાર્ય) છે, સિવાય તે લોકોના માટે કે જેઓ નમ્ર છે:

الَّذِينَ يُظُنُّونَ أَنَّهُمْ مُلْقُوا رَبِّهِمْ وَأَنَّهُمْ إِلَيْهِ رَاجِعُونَ ﴿٣٨﴾

(૪૬) કે જેઓ પોતાના પરવરદિગારની મુલાકાતની તેમજ તેની તરફ પાછા રજુ થવાની સંપૂર્ણ ખાતરી રાખે છે

يَبْنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ ﴿٣٩﴾

(૪૭) અથ ઈસરાઈલના વંશજો! મારી તે બક્ષિશોને યાદ કરો કે જે મેં તમને અર્પણ કરી

હતી તથા એ વાતને (પણ યાદ કરો) કે મેં તમને  
આખા જગત ઉપર સરસાઈ આપી હતી.

وَاتَّقُوا يَوْمًا لَا تَجْزِي نَفْسٌ عَنْ نَفْسٍ شَيْئًا وَلَا يُقْبَلُ مِنْهَا  
شَفَاعَةٌ وَلَا يُؤْخَذُ مِنْهَا عَدْلٌ وَلَا هُمْ يُنصَرُونَ ﴿٣٨﴾

(૪૮) અને તે દિવસથી ડરો કે જે દિવસે કોઈ પણ  
વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિના (બદલા તરીકે)  
કોઈપણ પ્રકારે કામમાં આવશે નહિ, તેમજ કોઈની  
તેના માટે ભલામણ કબૂલ કરવામાં આવશે નહિ,  
તથા કોઈ પણ જાતનો બદલો તેની પાસેથી  
લેવામાં આવશે નહિ, અને કોઈ પણ જાતની મદદ  
તેમને કરવામાં આવશે નહિ.

وَأَذِّنْ لِكُمْ مِنَ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ  
يَذِيبُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۗ وَفِي ذَلِكُمْ بَلَاءٌ  
مِّن رَّبِّكُمْ عَظِيمٌ ﴿٣٩﴾

(૪૯) અને (તે સમયને યાદ કરો) જ્યારે અમોએ તમને ફિરઓનીઓના હાથથી છુટકારો આપ્યો; તેઓ તમને દુષ્ટ (અને ભયંકર) શિક્ષા કરતા હતા, તમારા પુત્રોને કાપી નાખતા હતા તથા તમારી પુત્રીઓને જીવતી રહેવા દેતા હતા; અને તેમાં તમારા પરવરદિગાર તરફથી તમારા માટે ઘણી મોટી કસોટી હતી.

وَإِذْ فَرَقْنَا بِكُمْ الْبَحْرَ فَأَنْجَيْنَاكُمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ  
وَأَنْتُمْ تَنْظُرُونَ ﴿٥٠﴾

(૫૦) અને (તે સમયને યાદ કરો) જ્યારે અમોએ તમારા માટે સમુદ્રને ચીરી નાખ્યો (તેમાં તમને માર્ગ કરી આપ્યો), અને (તેમ કરીને) તમને (ફિરઔનીઓના હાથમાંથી દરિયા પાર ઉતારી) છુટકારો આપ્યો, અને તમારા દેખતાં દેખતાં જ ફિરઔનીઓને ડુબાડી દીધા.

وَإِذْ وَعَدْنَا مُوسَىٰ أَرْبَعِينَ لَيْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْ  
بَعْدِهِ وَأَنْتُمْ ظَالِمُونَ ﴿٥١﴾



(પ૧) અને (તે પણ યાદ કરો) જ્યારે અમોએ મૂસાને ચાલીસ રાત્રિઓનો વાયદો આપી (તુર પર બોલાવ્યા) પછી તમે તેની ગેરહાજરીમાં વાછરડાને પોતાનો મઅબુદ બનાવી બેઠા અને (તેમાં) તમે જ ઝુલમગાર હતા

ثُمَّ عَفَوْنَا عَنْكُمْ مِّنْ بَعْدِ ذَلِكَ لَعَلَّكُمْ تَشْكُرُونَ ﴿٥٢﴾

(પ૨) આ છતાંય તેના પછી અમોએ તમારાથી દરગુજર કરી કે કદાચને તમે આભાર માનવા લાગો.

وَإِذْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُونَ ﴿٥٣﴾

(પ૩) અને (તે સમયને યાદ કરો) જ્યારે અમોએ મૂસાને તે કિતાબ (તૌરત) તથા ફુરકાન (સત્ય

અસત્યનો નિર્ણય કરનાર નિયમો) અર્પણ કર્યા કે  
કદાચને તમે સન્માર્ગે ચાલો.

وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ لِقَوْمِهِ إِنَّكُمْ أَنْظَرْتُمْ أَنْفُسَكُمْ  
بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوبُوا إِلَىٰ بَارِئِكُمْ فَاقْتُلُوا أَنْفُسَكُمْ ط  
ذِكُمْ خَيْرٌ لَّكُمْ عِنْدَ بَارِئِكُمْ ط فَتَابَ عَلَيْكُمْ ط إِنَّهُ  
هُوَ التَّوَّابُ الرَّحِيمُ ﴿٥٣﴾

(૫૪) અને (તે સમયને યાદ કરો) જ્યારે મૂસાએ  
પોતાની કૌમને કહ્યું કે અચ મારી કૌમ! નિસંશય  
તમોએ વાછરડાની પૂજા કરીને હાથે કરી તમારા  
પોતા પર ઝુલ્મ કર્યો છે, હવે તમારા પેદા  
કરનારની હુજુરમાં તૌબા કરો અને (તમારાજ

હાથે) તમારામાંના (વાછરડાને પૂજનારા) ઓને કતલ કરી નાખો એજ તમારા પેદા કરનાર પાસે તમારા હકમાં બહેતર છે. પછી તમારી તૌબા (અલ્લાહે) સ્વીકારી; બેશક, તે મહાન તૌબાનો સ્વીકારનાર (અને) દયા કરનાર છે.

وَإِذْ قُلْتُمْ يَا مُوسَى لَنْ نُؤْمِنَ لَكَ حَتَّىٰ تَرَىٰ اللَّهَ جَهْرَةً  
فَأَخَذَتْكُمُ الصُّعِقَةُ وَأَنْتُمْ تَنْظُرُونَ ﴿٥٥﴾

(૫૫) અને જ્યારે તમોએ કહ્યું કે અય મૂસા! જ્યાં સુધી અમે અલ્લાહને નરી આંખે જોઈ ન લઈએ ત્યાં સુધી તારા પર હરગિજ ઈમાન લાવશું નહિ, ત્યારે જોત જોતામાંજ જ તમને વીજળીએ પકડી પાડ્યા.

ثُمَّ بَعَثْنَاكُمْ مِنْ بَعْدِ مَوْتِكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ ﴿٥٦﴾

(૫૬) પછી અમોએ તમારા (આ) મરણ બાદ તમને (પુનઃ) સજીવન કર્યા કે કદાચને તમે (અમારો) આભાર માનો.

وَوَلَّلْنَا عَلَيْكُمُ الْغَمَامَ وَأَنْزَلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَى ط  
كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ ط وَمَا ظَلَمُونَا وَلَكِنْ كَانُوا  
أَنْفُسَهُمْ يَظْلِمُونَ ﴿٥٧﴾

(૫૭) અને અમોએ તમારા પર વાદળાની છાયા કરી તથા તમારા માટે મન્ના તથા સલ્વા (નામના ખોરાકો) ઉતાર્યા; (અને તમને હુકમ કર્યો કે) જે સ્વચ્છ ચીજોની રોજી અમોએ તમને આપી છે

તેમાંથી ખૂબ ખાઓ પીઓ; અને (આ છતાં તમે ઉપકાર માનનારા બન્યા નહિ) આમ કર્યાથી તેઓએ અમારું કશું બગાડ્યું નહિ બલકે તેઓએ પોતાનાજ ઉપર ઝુલ્મ કર્યો.

وَإِذْ قُلْنَا ادْخُلُوا هَذِهِ الْقَرْيَةَ فَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ رَغَدًا وَّادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُولُوا حِطَّةٌ نَّغْفِرْ لَكُمْ خَطِيئَتَكُمْ ۗ وَسَنَزِيدُ الْمُحْسِنِينَ ﴿٥٩﴾

(૫૮) અને (તે સમયને યાદ કરો) જ્યારે અમોએ કહ્યું કે આ શહેરમાં દાખલ થાઓ અને તેમાં જ્યાંથી જે કાંઈ યાહો તે ખૂબ ખાઓ પીઓ અને આ દરવાજામાંથી સિજદો કરતા તથા 'ક્ષમા'

'ક્ષમા' બોલતા દાખલ થાઓ, (એટલે) અમે તમારા ગુનાહ માફ કરી દઈશું અને (તમારામાંના) જે સદાચારીઓ હશે તેમને વધારે સારો બદલો આપીશું.

فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَنْزَلْنَا عَلَى

الَّذِينَ ظَلَمُوا رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ ﴿٥٩﴾

(૫૯) પછી ઝાલિમોએ જે કાંઈ તેમને કહેવામાં આવ્યું હતું તેને જુદાજ બોલોમાં (શબ્દોમાં) બદલી નાખ્યું આથી અમોએ જેમણે ઝુલ્મ કર્યો હતો તેમના ઉપર આકાશમાંથી એક કહેર ઉતાર્યો કારણ કે તેઓ નાફરમાની કરતા હતા.

وَإِذِ اسْتَسْقَىٰ مُوسَىٰ لِقَوْمِهِ فَقُلْنَا اضْرِبْ بِعَصَاكَ الْحَجَرَ ط  
 فَانفَجَرَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ط قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ  
 مَّشْرَبَهُمْ ط كُلُوا وَاشْرَبُوا مِنْ رِزْقِ اللَّهِ وَلَا تَعْتُوا فِي الْأَرْضِ  
 مُفْسِدِينَ ۖ ﴿٦٠﴾

(૬૦) અને (તે સમયને યાદ કરો) જ્યારે મૂસાએ પોતાની કોમ માટે પાણી માંગ્યું ત્યારે અમોએ કહ્યું કે આ પથર ઉપર તારી લાકડી માર; (તેમ કરવાથી) તેમાંથી બાર ઝરણાં ફુટી નીકળ્યા; દરેક ટોળાએ પોતપોતાની પીવાની જગ્યા ઓળખી કાઢી; (પછી અમોએ હુકમ કર્યો કે) અલ્લાહે તમને

આપેલી રોજીમાંથી ખાઓ અને પીઓ પૃથ્વી ઉપર  
ત્રાસનું વાતાવરણ ઉપસ્થિત કરો નહીં.

وَإِذْ قُلْتُمْ يَا مُوسَى لَنْ نَصْبِرَ عَلَىٰ طَعَامٍ وَاحِدٍ فَادْعُ لَنَا رَبَّكَ  
يُخْرِجْ لَنَا مِمَّا تُنْبِتُ الْأَرْضُ مِنْ بَقْلِهَا وَقِثَّائِهَا وَفُومِهَا  
وَعَدْسِهَا وَبَصِلِهَا ط قَالَ أَتَسْتَبْدِلُونَ الَّذِي هُوَ أَدْنَىٰ بِالَّذِي  
هُوَ خَيْرٌ ط اهْبِطُوا مِصْرًا فَإِنَّ لَكُمْ مِمَّا سَأَلْتُمْ ط وَضُرِبَتْ  
عَلَيْهِمُ الذِّلَّةُ وَالْمَسْكَنَةُ ت وَبَاءُوا بِغَضَبٍ مِّنَ اللَّهِ ط ذَلِكَ  
بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ النَّبِيِّنَ بِغَيْرِ  
الْحَقِّ ط ذَلِكَ بِمَا عَصَوْا وَكَانُوا يَعْتَدُونَ ٦١ ع



(૬૧) અને (તે સમયને યાદ કરો) જ્યારે તમોએ કહ્યું કે અય મૂસા! અમે એકજ પ્રકારના ખોરાક ઉપર કદી પણ સંતોષ રાખશું નહીં માટે તું તારા પરવરદિગાર પાસે દુઆ કર કે જમીનમાંથી જે જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે (જેવી કે) શાક, ભાજી, કાકડી, ઘઉં, મસુર અને ડુંગળી (વિગેરે) અમારા માટે પણ ઉત્પન્ન કરે; (મૂસાએ) ફરમાવ્યું કે શું તમે ઉમદા વસ્તુઓને સાધારણ વસ્તુઓથી બદલવા યાહો છો? (જો એમ હોય) તો કોઈ શહેરમાં ઉતરી પડો કે (જેથી) જે વસ્તુઓનો તમોએ સવાલ કર્યો છે તે નિસંશય તમને (ત્યાં) મળશે. અને તેમના પર હીણપત અને કંગાલીયત આવી પડી અને

તેમણે (હાથે કરીને) પોતાના પર અલ્લાહનો કોપ  
 વ્હોરી લીધો; આ એટલા માટે કે અલ્લાહની  
 નિશાનીઓનો તેઓ ઈન્કાર કરતા હતા અને  
 નબીઓને વિના વાંકે મારી નાખતા હતા; (વળી)  
 એટલા માટે કે તેઓ નાફરમાની કરતા હતા અને  
 હદ ઉપરાંત અત્યાચાર કરતા હતા.

إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالنَّصْرِي وَالصَّبِيَّيْنَ مَنْ  
 آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَهُمْ أَجْرُهُمْ عِنْدَ  
 رَبِّهِمْ ۖ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ﴿٦٢﴾

(૬૨) નિસંશય! જેઓ ઈમાન લાવ્યા છે અને જેઓ  
 યહૂદીઓ અને ખ્રિસ્તીઓ અને સાબેઈન

(સિતારાઓને પૂજનારા) છે, જે કોઈ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન લાવશે તથા સત્કાર્ય કરશે તો તેનો બદલો તેમના માટે તેમના પરવરદિગાર પાસે હશે જ; અને તેમને ન તો કાંઈ ભય રહેશે અને ન તો તેઓ ઉદાસ થશે.

وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ ط خُذُوا مَا آتَيْنَكُم بِقُوَّةٍ وَاذْكُرُوا مَا فِيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ ﴿١٣﴾

(૬૩) અને (તે સમયને યાદ કરો) જ્યારે અમોએ તમારી પાસેથી વચન લીધું તથા (સીના) પર્વત તમારા માથા ઉપર ઉચકી ધરી રાખ્યો; (અને હુકમ કર્યો કે) જે કાંઈ (તૌરેતની આજ્ઞાઓ) અમોએ તમને આપી છે તેને દ્રઢતા પૂર્વક વળગી રહો,

અને જે તેમાં છે તે ધ્યાનમાં રાખો કે કદાચને તમે પરહેઝગાર બનો.

ثُمَّ تَوَلَّيْتُمْ مِّنْ بَعْدِ ذَلِكَ ۖ فَلَوْ لَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ  
وَرَحْمَتُهُ لَكُنْتُمْ مِنَ الْخٰسِرِينَ ﴿٦٣﴾

(૬૪) આ પછી પાછા તમે ફરી ગયા, પણ જો અલ્લાહની કૃપા તથા તેની દયા તમારા ઉપર ન હોત તો તમે ખચીતજ હાનિ ભોગવનારાઓ માંહેના થઈ જતે.

وَلَقَدْ عَلِمْتُمُ الَّذِينَ اعْتَدَوْا مِنْكُمْ فِي السَّبْتِ فَقُلْنَا لَهُمْ  
كُونُوا قِرَدَةً خٰسِئِينَ ﴿٦٥﴾

(૬૫) અને તમારામાંથી જેઓ સબ્ત (શનિવારના દિવસે શિકાર ન કરવાના હુકમનું ઉલ્લંઘન કરવા) માં હદ બહાર ગયા (તેમની શી દશા થઈ) તે તમે ખચીતજ જાણી ચૂક્યા છો. આથી અમોએ તેમને કહ્યું કે તમે હડધૂત થઈને વાંદરા બની જાઓ.

فَجَعَلْنَاهَا نَكَالًا لِّمَا بَيْنَ يَدَيْهَا وَمَا خَلْفَهَا وَمَوْعِظَةً  
لِّلْمُتَّقِينَ ﴿٦٦﴾

(૬૬) પછી અમોએ આ (બનાવ) તે તેમના સાથીઓ તથા (તેમની) પાછળ આવનારાઓ માટે દ્રષ્ટાંત, અને પરહેઝગારો માટે બોધપાઠ બનાવ્યો.

وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَنْ تَذْبَحُوا بَقَرَةً ۗ  
قَالُوا أَتَتَّخِذُنَا هُزُؤًا ۗ قَالَ أَعُوذُ بِاللَّهِ أَنْ أَكُونَ مِنَ  
الْجَاهِلِينَ ﴿٦٧﴾

(૬૭) અને (તે સમયને યાદ કરો) જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે નિસંશય અલ્લાહ તમને એક ગાય ઝબેહ કરવાનો હુકમ કરે છે (ત્યારે) તેમણે કહ્યું કે શું તું અમારી મજકરી કરે છે ? (મૂસાએ) કહ્યું કે અલ્લાહ ન કરે કે હું અજ્ઞાનીઓ માંહેનો થાઉં.

قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّنْ لَنَا مَا هِيَ ۖ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا  
 بَقْرَةٌ لَا فَارِضٌ وَلَا بَكْرٌ ۖ عَوَانٌ بَيْنَ ذَلِكَ ۖ فَافْعَلُوا مَا  
 تُمَرُونَ ﴿٦٨﴾

(૬૮) તેમણે કહ્યું કે તું તારા પરવરદિગારને  
 અમારા માટે વિનંતી કર કે તે ગાય કેવી છે તે  
 ખુલાસાથી અમારા માટે વર્ણવે; (મૂસાએ) કહ્યું કે  
 નિસંશય (અલ્લાહ) ફરમાવે છે કે તે એક ગાય છે  
 જે નથી ઘરડી કે નથી જુવાન પણ બન્નેની  
 વચ્ચેની છે; જેથી તમને જે આજ્ઞા આપવામાં  
 આવી છે તેનું પાલન કરો.

قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّنْ لَنَا مَا لُونُهَا ۖ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا  
بَقْرَةٌ صَفْرَاءٌ ۖ فَاقْعُبْ لُونَهَا تَسْرُ النَّظِيرِينَ ﴿٦٩﴾

(૬૯) તેમણે (પાછું) કહ્યું કે તારા પરવરદિગારને  
અમારા માટે વિનંતી કર કે તેનો રંગ કેવો છે તે  
અમોને સાફ સાફ જણાવી દે. (મૂસાએ) કહ્યું કે  
નિસંશય (અલ્લાહ) ફરમાવે છે તે ગાય એવા ઘેરા  
પીળા રંગની છે કે જોનારાઓને ખુશ કરી નાખે.

قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّنْ لَنَا مَا هِيَ ۖ إِنَّ الْبَقَرَ تَشْبَهُ  
عَلَيْنَا ۗ وَإِنَّا إِن شَاءَ اللَّهُ لَمُهْتَدُونَ ﴿٧٠﴾

(૭૦) તેમણે (ફરીથી) કહ્યું કે તારા પરવરદિગારને  
અમારા માટે વિનંતી કર કે તે ખુલાસાથી વર્ણવે કે



તે ગાય કેવી છે, નિસંશય તે ગાય ઓળખી  
કાઢવામાં અમે શંકાશીલ છીએ; અને નિસંશય જો  
અલ્લાહ યાહશે તો અમે જરૂર ખરા માર્ગ ઉપર  
આવી જઈશું.

قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَا ذَلُولَ تُثِيرُ الْأَرْضَ وَلَا تَسْقِي  
الْحَرْثَ ۗ مُسَلَّمَةٌ لَا شِيَةَ فِيهَا ط قَالُوا الْإِن جِئْتَ بِالْحَقِّ ط  
فَذَبْحُوهَا وَمَا كَادُوا يَفْعَلُونَ ۙ

(૭૧) (મૂસાએ) કહ્યું કે નિસંશય (અલ્લાહ) ફરમાવે  
છે કે તે ગાય એવી છે કે જેને જમીન ખેડવા  
અથવા ખેતરોને પાણી પાવા માટે હજી પલોટી  
(કામે લગાડી) ન હોય; (તેમજ) સાજી તંદુરસ્ત

(અને) ખોડ ખાંપણ વિનાની હોય; (આથી) તેઓ બોલ્યા હવે તેં ઠીક ઠીક જણાવ્યું; પછી તેમણે તે (ગાય) ને ઝબેહ કરી, જો કે તેઓ આ કાર્ય કરશે એવી આશા ન હતી. (કારણ કે તેની તેમને ઘણી વધારે કિંમત આપવી પડી.)

وَإِذْ قَتَلْتُمْ نَفْسًا فَادْرَأْتُمْ فِيهَا ط وَاللَّهُ مُخْرِجٌ مَّا كُنْتُمْ  
تَكْتُمُونَ ﴿٤٦﴾

(૭૨) અને (તે સમય યાદ કરો) જ્યારે તમોએ એક શખ્સને મારી નાખ્યો પછી તેના (ખૂનીના) સંબંધમાં તમે મતભેદ કર્યો અને જે કાંઈ તમે સંતાડતા હતા તે તો અલ્લાહ જાહેર કરનાર હતો જ.

فَقُلْنَا اضْرِبُوهُ بِبَعْضِهَا ۗ كَذَلِكَ يُحْيِي اللَّهُ الْمَوْتَى ۗ وَيُرِيكُمْ  
 آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ ﴿٤٣﴾

(૭૩) પછી અમોએ કહ્યું કે આ (ઝબેહ કરેલી) ગાયનો એક ભાગ (લઈને) તેના શબ પર મારો (તેમ કરતાં તે સજીવન થઈ ગયો) એવી રીતે અલ્લાહ મરણ પામેલાઓને સજીવન કરે છે અને તમને પોતાની નિશાનીઓ દેખાડે છે કે કદાચને તમે સમજો.

ثُمَّ قَسَتْ قُلُوبُكُمْ مِّنْ بَعْدِ ذَلِكَ فَهِيَ كَالْحِجَارَةِ أَوْ أَشَدُّ  
 قَسْوَةً ۗ وَإِنَّ مِنَ الْحِجَارَةِ لِمَا يَتَفَجَّرُ مِنْهُ الْأَنْهَارُ ۗ وَإِنَّ مِنْهَا

لَهَا يَشَقُّ فَيَخْرُجُ مِنْهُ الْمَاءُ ط وَإِنَّ مِنْهَا لَمَاءً يَهِبُطُ مِنْ  
خَشْيَةِ اللَّهِ ط وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ ﴿٧٤﴾

(૭૪) તે બાદ તમારા દિલો પાછા સખત થઈ  
ગયાં છેવટે તે પથર જેવાં (સખત) થયાં અથવા  
તેથી પણ વધારે સખત; અને નિસંશય  
પથરોમાંથી કેટલાક એવા હોય છે કે જેમાંથી  
પાણીના ઝરણાં ફૂટી નીકળે છે, અને નિસંશય  
તેમાંથી કેટલાક એવા હોય છે કે જે ફાટી જાય છે  
પછી તેમાંથી (પણ) પાણી નીકળે છે, અને  
નિસંશય તેમાંથી કેટલાક એવા પણ હોય છે કે  
અલ્લાહના ભયથી ધુજીને નીચે પડે છે. અને તમે  
જે કાંઈ કરો છે તેનાથી અલ્લાહ અજાણ નથી.

أَفَتَطْمَعُونَ أَنْ يُؤْمِنُوا بِالْكُمْ وَقَدْ كَانَ فَرِيقٌ مِّنْهُمْ يَسْمَعُونَ  
كَلِمَ اللَّهِ ثُمَّ يُحَرِّفُونَهُ مِنْ بَعْدِ مَا عَقَلُوهُ وَهُمْ يَعْلَمُونَ ﴿٥٥﴾

(૭૫) (અય મુસલમાનો) શું તમારી એવી ઈચ્છા છે કે તેઓ તમારું માને? જ્યારે તેઓ માંહેનું એક ટોળું એવું છે કે તે અલ્લાહનો કલામ (બોલ) સાંભળે છે, પછી તેઓ તેને સમજી ચૂકયા બાદ પણ જાણી જોઈને તેમાં ફેરફાર કરી નાખે છે.

وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَا بِبَعْضِهِمْ إِلَى  
 بَعْضٍ قَالُوا اتَّخَذُوا آلَهُمُ بِمَا فَتَحَ اللَّهُ عَلَيْكُمْ لِيُحَاجُّوكُمْ بِهِ  
 عِنْدَ رَبِّكُمْ أَفَلَا تَعْقِلُونَ ﴿٦٦﴾

(૭૬) વળી જ્યારે તેઓ મોમીનો સાથે મુલાકાત  
 કરે છે ત્યારે કહે છે કે અમે ઈમાન લઈ આવ્યા  
 છીએ, પણ જ્યારે એકાંતમાં આપસમાં મળે છે  
 ત્યારે કહે છે કે શું તમે તેમને તે વાતો કહીદો છો  
 કે જે અલ્લાહે તમને જણાવી દીધી છે કે જેથી  
 તેઓ તમારા પરવરદિગારની હજુરમાં એજ વડે  
 તમારા ઉપર દલીલો કાયમ કરે? શું તમે (એટલું  
 પણ) સમજતા નથી?

أَوْ لَا يَعْلَمُونَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ﴿٤٤﴾

(૭૭) શું તેઓ નથી જાણતા કે તેઓ જે કાંઈ સંતાડે છે તથા જે કાંઈ જાહેર કરે છે તે અલ્લાહ જાણે છે?

وَمِنْهُمْ أُمِّيُونَ لَا يَعْلَمُونَ الْكِتَابَ إِلَّا أَمَانِيَّ وَإِنْ هُمْ إِلَّا يَظُنُّونَ ﴿٤٥﴾

(૭૮) અને તેઓ (અહ્મદીઓ) માંહેના કેટલાક એવા અભણ છે કે જેઓ કિતાબ (તૌરત)ને સમજતા નથી પણ આ કે તે (તૌરત) તેમની ઈચ્છાઓ પ્રમાણે છે અને આ તેઓની માત્ર એક અટકળ છે.

فَوَيْلٌ لِلَّذِينَ يَكْتُبُونَ الْكِتَابَ بِأَيْدِيهِمْ ۖ ثُمَّ يَقُولُونَ هَذَا  
 مِنْ عِنْدِ اللَّهِ لِيَشْتَرُوا بِهِ ثَمَنًا قَلِيلًا ۗ فَوَيْلٌ لَهُمْ مِمَّا  
 كَتَبَتْ أَيْدِيهِمْ وَوَيْلٌ لَهُمْ مِمَّا يَكْسِبُونَ ﴿٤٩﴾

(૭૯) માટે અફસોસ છે તેમના માટે જેઓ કિતાબ  
 પોતાને જ હાથે લખે છે, અને પછી કહે છે કે આ  
 અલ્લાહના તરફથી છે કે જેથી તેને થોડીક  
 કિંમતમાં (પોતાના સ્વાર્થ માટે) વેચી શકે; વળી  
 અફસોસ છે તેમના માટે કે જે તેમના હાથોએ  
 લખ્યું અને અફસોસ છે તેમની તે (વસ્તુ) માટે કે  
 જે તેઓ કમાય છે.



وَقَالُوا لَنْ نَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَعْدُودَةً ۗ قُلْ أَتَّخَذْتُمْ  
عِنْدَ اللَّهِ عَهْدًا فَلَنْ يُخْلِفَ اللَّهُ عَهْدَهُ أَمْ تَقُولُونَ عَلَى اللَّهِ مَا  
لَا تَعْلَمُونَ ﴿٨٠﴾

(૮૦) અને તેઓ કહે છે કે અમને તો ગણ્યાં ગાંઠ્યા  
દિવસો સિવાય (જહન્નમની) આગ કોઈ કાળે  
અડકશે નહિ; (અય રસૂલ!) તું કહે કે શું તમોએ  
અલ્લાહ પાસેથી કોઈ વચન લઈ લીધું છે? (જો  
એમ હોય તો) અલ્લાહ પોતાના વચન વિરુદ્ધ કદી  
પણ વર્તશે નહિ, અથવા શું તમે જાણ્યા સમજ્યા  
વિના અલ્લાહ વિરુદ્ધ વાતો ઘડી કાઢો છો?

بَلَىٰ مَنْ كَسَبَ سَيِّئَةً وَأَحَاطَتْ بِهِ خَطِيئَتُهُ فَأُولَٰئِكَ  
أَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُونَ ﴿٨١﴾

(૮૧) હા, જેણે કોઈ દુષ્ટ કમાઈ કરી અને તેને તેના ગુનાહોએ ઘેરી લીધો (તો) તેઓજ જહન્નમવાસીઓ છે, જેમાં તેઓ હંમેશ માટે રહેનાર છે.

وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ هُمْ  
فِيهَا خَالِدُونَ ﴿٨٢﴾

(૮૨) અને જેઓ ઈમાન લાવ્યા છે અને સત્કાર્યો કરે છે તેઓ જ સ્વર્ગવાસીઓ છે, જેમાં તેઓ હંમેશ માટે રહેનાર છે.

وَإِذْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ لَا تَعْبُدُونَ إِلَّا اللَّهَ  
 وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسْكِينِ وَقُولُوا  
 لِلنَّاسِ حُسْنًا وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ثُمَّ تَوَلَّيْتُمْ  
 إِلَّا قَلِيلًا مِّنْكُمْ وَأَنْتُمْ مُّعْرِضُونَ ﴿٨٣﴾

(૮૩) અને (તે સમયને યાદ કરો) જયારે અમોએ  
 ઈસરાઈલના વંશજો પાસેથી વચન લીધું કે તમે  
 અલ્લાહ સિવાય અન્યની ઈબાદત કરશો નહિ,  
 અને મા બાપની સાથે ભલાઈથી વર્તતા રહેશો  
 અને સગાવહાલાં તથા અનાથો તથા નિરાધારોની  
 સાથે પણ; અને લોકો સાથે વિવેકથી વાત કરો  
 અને નમાઝ પઢતા રહો તથા ઝકાત આપતા રહો;

(પણ) પાછળથી તમારામાંના કેટલાક લોકો સિવાય (સઘળાજ) ફરી ગયા, અને તમે મોઢું ફેરવો એવા જ છો.

وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ لَا تَسْفِكُونَ دِمَاءَكُمْ وَلَا تُحْرِجُونَ

أَنْفُسَكُمْ مِنْ دِيَارِكُمْ ثُمَّ أَقْرَرْتُمْ وَأَنْتُمْ تَشْهَدُونَ ﴿٨٤﴾

(૮૪) અને (તે સમયને યાદ કરો) જ્યારે અમોએ તમારી પાસેથી વચન લીધું કે તમે અંદરો અંદર ખૂનરેજી કરશો નહિ તેમજ તમારા માંહેના (લોકો) ને તમારા શહેરમાંથી કાઢી મૂકશો નહિ, પછી તે તમોએ કબૂલ કર્યું અને તમે (તે વખતે) હાજર પણ હતા.

ثُمَّ أَنْتُمْ هَؤُلَاءِ تَقْتُلُونَ أَنْفُسَكُمْ وَتُخْرِجُونَ فَرِيقًا مِّنْكُمْ  
 مِّن دِيَارِهِمْ تَظْهَرُونَ عَلَيْهِم بِالْإِثْمِ وَالْعُدْوَانِ ط وَإِنَّ  
 يَأْتِيَكُمْ أَسْرَى تَفْدُوهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَيْكُمْ إِخْرَاجُهُمْ ط  
 أَفْتُومِنُونَ بِبَعْضِ الْكِتَابِ وَتَكْفُرُونَ بِبَعْضٍ ؕ فَمَا جَزَاءُ  
 مَنْ يَّفْعَلْ ذَلِكَ مِنْكُمْ إِلَّا خِزْيٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ؕ وَيَوْمَ  
 الْقِيَامَةِ يُرَدُّونَ إِلَىٰ أَشَدِّ الْعَذَابِ ط وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا  
 تَعْمَلُونَ ﴿٨٥﴾

(૮૫) તે છતાંય તમે એજ છો કે પોતાનાઓને  
 મારી નાખો છો, તથા તમારા માંહેના એક ટોળાને  
 તેમના ઘરોમાંથી કાઢી મૂકો છો, અને તેમની વિરુદ્ધ

ગુનાહ તથા અત્યાચાર કરવામાં એક બીજાને મદદ આપો છો; અને જ્યારે તેમને તમારી સામે બંદીવાન બનાવીને લાવવામાં આવે છે ત્યારે તમે બદલો આપીને તેમને છોડાવો છો, જો કે તેમને કાઢી મુકવાનું (કૃત્યજ) તમારા માટે હરામ ઠરાવવામાં આવ્યું હતું; શું ત્યારે તમે કિતાબના અમૂક ભાગને માનો છો અને અમુક (ભાગ) ને માનતા નથી? માટે તમારામાંથી જે કોઈ આવું કરે તેના માટે આલોકની જિંદગીમાં નામોશી સિવાય બીજો શો બદલો છે? અને કયામતના દિવસે (પણ) તેમને ઘણી સખત શિક્ષા તરફ ફેરવવામાં

આવશે; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ અજાણ નથી.

أُولَئِكَ الَّذِينَ اشْتَرُوا الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ؛ فَلَا يُخَفَّفُ  
عَنَّهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنصَرُونَ ﴿٧١﴾

(૮૬) આ એજ લોકો છે કે જેઓ આખેરતના બદલે દુનિયાની જિંદગી ખરીદે છે, માટે તેમની સજા હરગિઝ હળવી કરવામાં આવશે નહિ તેમજ તેમને કોઈ પ્રકારની સહાય પણ કરવામાં આવશે નહિ.

وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَقَفَّيْنَا مِنِّي بَعْدَهُ  
بِالرُّسُلِ؛ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ

الْقُدْسُ ط أَفْكَلَمَا جَاءَكُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَى أَنْفُسُكُمْ  
اسْتَكْبَرْتُمْ ء فَفَرِيقًا كَذَّبْتُمْ ۖ وَفَرِيقًا تَقْتُلُونَ ﴿٧٤﴾

(٧٤) અને ખચીતજ અમોએ મૂસાને કિતાબ અર્પણ કરી તથા તેના પછી બીજા પયગમ્બરો એક પછી એક મોકલ્યા, અને અમોએ મરિયમના પુત્ર ઈસાને ખુલ્લી નિશાનીઓ આપી તથા રૂહુલકુદુસ (જિબ્રઈલ) દ્વારા તેની મદદ કર્યા કરી; પણ શું (એવું નથી બન્યું કે) જ્યારે જ્યારે કોઈ રસૂલ તમારી પાસે તમારી ઈચ્છા વિરુદ્ધનો હુકમ લઈ આવ્યો ત્યારે ત્યારે તમે અહંકાર કરતાજ રહ્યા, પછી કેટલાકને જૂઠા પાડ્યા, (ત્યારે) કેટલાકને કતલ કરી નાખ્યા.



وَقَالُوا قُلُوبُنَا غُلْفٌ ۗ بَلْ لَعَنَهُمُ اللَّهُ بِكُفْرِهِمْ فَقَلِيلًا مَّا  
يُؤْمِنُونَ ﴿٨٧﴾

(૮૮) એને તેઓ કહે છે કે અમારા અંતઃકરણો પર પડદા છે; (એમ નથી.) બલકે અલ્લાહે તેમની બેઈમાનીના કારણે તેમને ફિટકાર્યા છે, માટે ઘણાજ થોડા ઈમાન લાવશે.

وَلَمَّا جَاءَهُمْ كِتَابٌ مِّنْ عِنْدِ اللَّهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ ۖ  
وَكَانُوا مِنْ قَبْلُ يَسْتَفْتِحُونَ عَلَى الَّذِينَ كَفَرُوا ۗ فَلَمَّا  
جَاءَهُمْ مَا عَرَفُوا كَفَرُوا بِهِ ۖ فَلَعْنَةُ اللَّهِ عَلَى الْكَافِرِينَ ﴿٨٩﴾

(૮૯) અને જ્યારે તેમની પાસે અલ્લાહની એક કિતાબ (કુરઆન) આવી કે જે તેમની પાસે (જે

કિતાબ) છે તેની સત્યતા બતાવનાર છે, પ્રથમ (ત્યારે તેઓએ તેને માની નહિ) જો કે પ્રથમ તેઓ પોતે નહિ માનનારાઓ વિરુદ્ધ (આવનાર પયગમ્બરની સહાયતાથી) વિજય મેળવવા માટે પ્રાર્થના કરતા હતા, પણ જ્યારે તેમની પાસે તે (પયગમ્બર) આવ્યો ત્યારે તેમણે (તેને) ઓળખ્યો નહિ, અને તેના પર ઈમાન લાવ્યા નહિ; માટે (તે) ઈમાન ન લાવનારાઓ પર અલ્લાહની ક્રિટિકાર હો જો.

بِئْسَمَا اشْتَرَوْا بِهِ أَنْفُسَهُمْ أَنْ يَكْفُرُوا بِمَا أَنْزَلَ اللَّهُ بَغْيًا  
 أَنْ يُنَزِّلَ اللَّهُ مِنْ فَضْلِهِ عَلَى مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ ۗ فَبَاءُؤُ  
 بِغَضَبٍ عَلَى غَضَبٍ ۖ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُهِينٌ ﴿٩٠﴾

(૯૦) કેવી ખરાબ છે તે વસ્તુ કે જેના બદલામાં તેમણે પોતાનો આત્મા વેચી નાખ્યા છે, (અને તે એ માટે) કે અલ્લાહે જે કાંઈ ઉતાર્યું છે તેનો તેઓ ઈન્કાર કરે, અને ઈર્ષા એટલા માટે કે અલ્લાહ પોતાના બંદાઓમાંથી યાહે છે તેના ઉપર પોતાની કૃપા ઉતારે છે (અને તેઓ યાહે છે તેના ઉપર નહિ) આથી તેઓ ક્રોધ ઉપર ક્રોધના હકદાર

બન્યા; અને ઈન્કાર કરનારાઓ માટે ફજેત કરનારી શિક્ષા છે.

وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا بِمَا أَنْزَلَ اللَّهُ قَالُوا نُوْمِنُ بِمَا أَنْزَلَ

عَلَيْنَا وَيَكْفُرُونَ بِمَا وَرَاءَهُ ۗ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَهُمْ ۗ ط

قُلْ فَلِمَ تَقْتُلُونَ أَنْبِيَاءَ اللَّهِ مِنْ قَبْلُ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ ۙ ۙ

(૯૧) અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે જે કાંઈ અલ્લાહે ઉતાર્યું છે તેના પર ઈમાન લાવો ત્યારે કહે છે કે અમારા પર જે કાંઈ ઉતારવામાં આવ્યું છે તેને તો અમે માનીએ છીએ અને તે ઉપરાંત તેઓ બીજું જે કાંઈ છે તેનો ઈન્કાર કરે છે, જો કે તે (કુરઆન) સત્ય છે, અને જે કાંઈ (તૌરેત)

તેમની પાસે છે તેની પણ સત્યતા બતાવનાર છે;  
માટે કહે કે જો તમે (ખરેખર) ઈમાન લાવનારા  
હતા તો આ પહેલાં (આવેલા) નબીઓને શા માટે  
કતલ કરતા હતા?

وَلَقَدْ جَاءَكُمْ مُوسَىٰ بِالْبَيِّنَاتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن  
بَعْدِهَا وَأَنْتُمْ ظَالِمُونَ ﴿٩٢﴾

(૯૨) અને ખચીતજ મૂસા તમારી પાસે ખુલ્લી  
દલીલો લઈને આવ્યો, પછી તેની ગેરહાજરીમાં  
તમે વાછરડાને પૂજવા લાગ્યા અને તેમાં તમે જ  
ઝુલમગાર હતા.

وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ ط خُذُوا مَا  
 آتَيْنَاكُمْ بِقُوَّةٍ وَّاسْمِعُوا ط قَالُوا سَمِعْنَا وَعَصَيْنَا ۗ وَأُشْرِبُوا  
 فِي قُلُوبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ ط قُلْ بِئْسَمَا يَأْمُرُكُمْ بِهِ  
 إِيْمَانُكُمْ إِن كُنْتُمْ مُؤْمِنِينَ ﴿٩٣﴾

(૯૩) અને (તે સમયને યાદ કરો) જ્યારે અમોએ તમારી પાસેથી પાકું વચન લીધું અને (સીના) પર્વતને તમારા માથા પર ઊંચકી ધરી રાખ્યો, (અને હુકમ કર્યો કે) જે કાંઈ અમોએ તમને આપ્યું છે તે દ્રઢતા પૂર્વક પકડી લો અને ધ્યાન દઈ સાંભળો; ત્યારે તેમણે કહ્યું કે અમોએ સાંભળી લીધું પરંતુ અમોએ નાફરમાની કરી; અને તેમની

નાફરમાનીના કારણે તેમના દિલોમાં વાછરડાં પ્રત્યેની માયા ઘર કરી ગઈ છે. (અથ રસૂલ) તું કહે કે જો તમે (એવા) ઈમાન લાવનારા હો તો તમારું ઈમાન તમને (ખરેજ) ઘણી ખરાબ આજ્ઞા કરે છે.

قُلْ إِنْ كَانَتْ لَكُمْ الدَّارُ الْآخِرَةُ عِنْدَ اللَّهِ خَالِصَةً مِّنْ دُونِ  
النَّاسِ فَتَمَنَّوْا الْمَوْتَ إِنْ كُنْتُمْ صَادِقِينَ ﴿٩٣﴾

(૯૪) (અને એ પણ કહે) કે જો આખેરતનું ઘર અલ્લાહને ત્યાં ખાસ તમારા માટે જ છે અને બીજા લોકો માટે નથી તો (એમ કહેવામાં) જો તમે સાચા હો તો મૃત્યુ માંગી લો.

وَلَنْ يَتَمَنَّوْهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۗ وَاللَّهُ عَلِيمٌ  
بِالظَّالِمِينَ ﴿٩٥﴾

(૯૫) પરંતુ તેઓ પોતાના હાથે જે આગળ મોકલી  
ચૂક્યા છે તે કારણે તેઓ તે (મૃત્યુ) ની હરગિઝ  
ઈચ્છા કરશે નહિ; અને અલ્લાહ ઝુલમગારોથી  
સારી પેઠે વાકેફ છે

وَلَتَجِدَنَّهُمْ أَحْرَصَ النَّاسِ عَلَى حَيَوٰةٍ ۖ وَمِنَ الَّذِينَ  
أَشْرَكُوا ۗ يَوَدُّ أَحَدُهُمْ لَوْ يُعَمَّرَ أَلْفَ سَنَةٍ ۖ وَمَا  
هُوَ بِمَزْحُوزٍ ۗ مِنَ الْعَذَابِ أَنْ يُعَمَّرَ ۗ وَاللَّهُ بَصِيرٌ ۗ بِمَا  
يَعْمَلُونَ ﴿٩٦﴾



(૯૬) અને તને નિઃસંશય માલૂમ પડશે કે તેઓ સર્વે બીજા માણસો કરતાં (સંસારી) જિંદગીના અત્યંત લોભિષ્ટ છે, એટલા બધા પ્રમાણમાં કે મુશ્કિલો કરતાંય વધારે, તેઓ માંહેનો દરેક એવું ઈચ્છે છે કે તે પોતે હજાર વર્ષ જીવે પરંતુ તેનું મોટી વયનું થવું (પણ) તેને (અમારી) શિક્ષાથી બચાવી શકનાર નથી; અને જે (વર્તન)તેઓ કરે છે તે અલ્લાહ સારી પેઠે નિહાળે છે.

قُلْ مَنْ كَانَ عَدُوًّا لِلْجَبْرِيلَ فَإِنَّهُ نَزَّلَهُ عَلَى قَلْبِكَ بِإِذْنِ اللَّهِ

مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ وَهُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ ﴿٩٤﴾

(૯૭) (અય રસૂલ!) તું કહે કે જે કોઈ જિબ્રિલનો દુશ્મન હશે (તે અલ્લાહનો દુશ્મન છે.) કારણ કે તે



















































































